

એપ્રિલ 4, 2018

## સીટી ઓફ બ્રામ્પટન કામગીરી પ્રદર્શિત કરતું ડેશબોર્ડ જાહેર કરે છે

બ્રામ્પટન, ઓન્ટેરિયો – સીટી ઓફ બ્રામ્પટન કામગીરી પ્રદર્શિત કરતા નવા ડેશબોર્ડની શરૂઆત કરીને, જુદી જ રીતે વિચારી રહ્યું છે. નવું [સીટી ડેશબોર્ડ 1.0](#) એક ઓનલાઇન સાધન છે જે શહેરની રોજંદી સંચાલન કામગીરીઓ કેવી રીતે સમુદાયના નિષ્કર્ષોમાં ફાળો આપે છે તે જોવામાં સમુદાયને મદદ કરે છે.

સીટી ડેશબોર્ડના ગ્રુપ્સ સેવાઓ, વ્યૂહાત્મક લક્ષ્યો અને સામુદાયિક સ્થિતિઓની છબી દર્શાવવા છ વિષયોમાં પગલાઓ દર્શાવે છે. **નાણાકીય બાબતો અને અસ્થિમતો** અને **ગ્રાહક સેવા** પાયાના સંચાલનલક્ષી અને વ્યૂહાત્મક નાણાકીય પગલાઓનું પ્રતિનિધિત્વ કરે છે. **સમુદાય સુખાકારી, રહેવાની યોગ્યતા, આર્થિક પાસુ** અને **શહેરી સ્વરૂપ** એવી બાબતોને પ્રતિબિંબિત કરે છે જેની પર શહેર સમુદાયમાં પ્રભાવ પાડવા અને સુધારો લાવવા, રોજંદા ધોરણે કામ કરતું હોય.

સ્થિતિ અને ગ્રાફની સાથે સાથે, દરેક પગલું એક કથનની લાક્ષણિકતા દર્શાવે છે જે શા માટે તેની જરૂર છે, તે કેવી રીતે માપવામાં આવે છે, અને શહેર પ્રગતિ કરી રહ્યું હોય, તેને લગતી વાત કરે છે. એક “**સંબંધિત કડીઓ (રિલેટેડ લિન્ક્સ)**” વિભાગ વ્યૂહાત્મક આયોજન પહેલો, રોજંદા સેવાઓ, કાર્યક્રમો, નકશાઓ, યોજનાઓ અને અભ્યાસો પર વધારે સંદર્ભ પૂરો પાડે છે.

ડેશબોર્ડ નિખાલસતા અને ઉત્તરદાયિત્વ પ્રત્યે શહેરની કટિબદ્ધતાને પુનઃલાગુ કરે છે. મ્યુનિસિપલ સેવા કામગીરી અને સામુદાયિક પગલાઓની દેખરેખ રાખવાથી એક સંકળાયેલા વૈશ્વિક શહેર તરીકે બ્રામ્પટનની વૃદ્ધિને ટેકો આપવા નવીન શોધ ચલિત કરવામાં અને સતત સુધારાઓ પર પ્રભાવ પાડવામાં મદદ મળશે.

બ્રામ્પટન શહેરનું ડેશબોર્ડ વેબસાઇટ પર જુઓ, [www.brampton.ca/dashboard](http://www.brampton.ca/dashboard). આવૃત્તિ 1.0 તરીકે, શહેર પોતાની ડેટા એકત્રીકરણ પ્રથાઓ શુદ્ધ કરતું રહે એટલે વધુ આવૃત્તિઓ આવતી રહેશે. શહેર ડેશબોર્ડમાં સ્થિત “**ડેશબોર્ડ ફીડબેક (પ્રતિભાવ)**” બટન મારફતે વપરાશકારોને કોઈ ટિપ્પણીઓ કે મૌલિક વિચારો વહેંચવા પ્રોત્સાહિત કરે છે.

### અવતરણો (ક્વૉટ્સ):

“આપણી 2016-2018 વ્યૂહાત્મક યોજનાએ મહત્વના કામગીરી સૂચકો વિકસાવવાની જરૂરિયાત ઓળખી કાઢી જે પારદર્શકતા અને ઉત્તરદાયિત્વ પ્રત્યે આપણી કટિબદ્ધતા દર્શાવે છે. આપણું શહેર જે શ્રેષ્ઠ કામગીરીઓ કરી રહ્યું હોય અને જ્યાં સુધારા માટેની શક્તિ જાણતી હોય તે સમજવાથી, આપણને આપણાં રહેવાસીઓ માટે જીવનની ગુણવત્તા સુધારવા સાથે જોડાવામાં, આગેવાની અને નવીન શોધ કરવામાં મદદ મળે છે.”

મેયર લિન્ડા જેફરી (Linda Jeffery)

“ભવિષ્ય માટે આપણાં સતત તૈયાર પરિવર્તન માટેની ચાવી અપવાદમય જાહેર સેવાઓ વિતરિત કરવા ગતિ, ચપળતા અને પ્રતિભાવ વધારવાની તકો શોધી રહી છે. સીટી ઓફ બ્રામ્પટનનું નવું ડેશબોર્ડ સતત સુધારાઓ પર આપણું ઉન્નત ધ્યાન કેન્દ્રિત હોવાનું દેખાડવાની એક રોમાંચક રીત છે, જે સમગ્ર કોર્પોરેશનમાં ઉચ્ચ કામગીરી અને નક્કર નિર્ણય લેવાની સંસ્કૃતિને ચલિત કરે છે.”

હૅરી શ્વાન્ગ (Harry Schlange), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર

-30-

બ્રામ્પટનમાં મોટા પાયે ફેરફારો થઈ રહ્યાં છે. આપણે વેધક ધ્યાન કેન્દ્રિત કરતા ભવિષ્ય માટે તૈયાર સંસ્થા છીએ. આપણે આપણાં સમુદાયની વૃદ્ધિ જાણીએ છીએ, જુવાની અને વિવિધતા આપણને અલગ અલગ કરે છે. આપણે કેનેડાના નવીન શોધ કરતા સુપર કોરિડોરના કેન્દ્રમાં સ્થિત, રોકાણ પ્રોત્સાહક અને આપણી વૈશ્વિક સફળતા વિકસાવનાર છીએ. આપણે કંપાયમાન શહેરી કેન્દ્રો વિકસાવીએ છીએ જે તક પ્રજ્વલિત કરે છે અને અહીં રહેતા અને કાર્યરત લોકોમાં ગૌરવ રેડીએ છીએ. આપણે બ્રામ્પટનને આગળ વધારી રહ્યાં છીએ જે તેને નવીનતમ, સર્વગ્રાહી અને જુરસામય શહેર બનાવે. અમને [Twitter](#) અને [Facebook](#) પર અનુસરો. [www.brampton.ca](http://www.brampton.ca) પર વધુ માહિતી જાણો.

**મીડિયા સંપર્ક (MEDIA CONTACT)**

નાટાલી સ્ટોગડિલ (Natalie Stogdill)

મીડિયા કોર્ડિનેટર (Media Coordinator)

સીટી ઓફ બ્રામ્પટન (City of Brampton)

905.874.3654 | [natalie.stogdill@brampton.ca](mailto:natalie.stogdill@brampton.ca)